



**સુરત મહાનગરપાલિકા**  
**રેકર્ડ વિભાગ**  
**આર.ટી.આઈ.ઓક્ટ-૨૦૦૫**



**પ્રોએક્ટીવ ડીસ્કલોઝર (પી.એ.ડી.)**  
**સને. ૨૦૨૩-૨૪**  
**તા. ૦૧-૦૫-૨૦૨૪ ની સ્થિતીએ**

**ઓફિસ :—**  
**રેકર્ડ વિભાગ**  
**સુરત મહાનગરપાલિકા**  
**ભંડારીવાડ, નાનપુરા, સુરત.**

**જાહેર માહિતી અધિકારી**  
**અને**  
**પ્રથમ શ્રેષ્ઠી કલાર્ક**  
**રેકર્ડ વિભાગ**  
**સુરત મહાનગરપાલિકા**

**માહિતી અધિકાર અધિનિયમ-૨૦૦૫ ની કલમ-૪(૧)(ખ)ની જોગવાઈ મુજબ  
તા.૦૧/૦૫/૨૦૨૪ ની પરિસ્થિતિએ હજુ મુદ્દાની પુસ્તકા પ્રસિદ્ધ કરવા બાબત.**

**(૧) આર.ટી.આઈ. ની કલમ-૧(૧)(બી)(૧ થી ૧૭) મુજબ પ્રોએક્ટીવ ડીસ્કલોગર  
અંગે રેકર્ડ વિભાગની વિગતો દર્શાવતું પત્રક**

**કલમ-૪(૧)(બી)(૧) : સંસ્થાના કાર્યો અને ફરજોની વિગત**

રેકર્ડ રૂલ્સ ૧૯૬૫ અંતર્ગત સુરત મહાનગરપાલિકાના જે તે વિભાગ દ્વારા વર્ગીકરણ કરવામાં આવેલ A,B,C,D,E કેટેગરીના રેકર્ડ તેમજ જુદી જુદી સમિતિઓની પ્રોસીડીંગ બુકો, મતદારયાદીઓ, રજીસ્ટરો, ફાઇલો પ્રિન્ટેડબુકો, વર્તમાન પત્રો વિગેરેની રેકર્ડની ફક્ત વર્ષવાર જાળવણી અને નિભાવણી કરવામાં આવે છે. તેમજ જેતે ખાતાને લગતાં રેકર્ડની જાળવણી અત્રેના વિભાગમાં ફક્ત વર્ષવાર થતી હોવાથી જે તે ખાતાઓને તેમના રેકર્ડની માહિતી જોઈતી હોઈ તો અત્રેથી તેમને એમનો રેકર્ડ સૌંપવામા/દફતરી નિરીક્ષણ કરી પરત આપવામાં આવે છે.

સુરત મહાનગરપાલિકાના જુદા જુદા વિભાગો દ્વારા અત્રેના વિભાગમાં જમા કરાવેલ રેકર્ડની મુદ્દત પુર્ણ થયેલ હોય તથા રેકર્ડની સાચવણી, જાળવણીની જરૂરીયાત ન રહેતી હોય તેવા બિનજરૂરી રેકર્ડ જે "નાશ પાત્ર રેકર્ડ" ની ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી માવો બનાવવાના કામ અંગે વેચાણ કરવામાં આવે છે. તદ્વારાંત અન્ય ખાતાઓની ઓફીસોના આવતા વર્તમાનપત્રોની પસ્તીનું ભાવપત્રક મંગાવી વેચાણ કરવામાં આવે છે.

સુરત મહાનગરપાલિકાની વિવિધ ખાતાઓ / ઝોન ઓફિસો / સિવિક સેન્ટરો દરેક વૉર્ડ ઓફિસો, હોસ્પિટલો, હેલ્થ સેન્ટરો પર દર વર્ષે ઉપયોગમાં લેવામાં આવતી રસીદબુકો/ ફોર્મ્સ તેમજ રજીસ્ટરો તથા અન્ય અગત્યની સ્ટેશનરીઓનું રેકર્ડ ઓફિસ (નંબરીંગ વિભાગ) દ્વારા તેનું સીલ/નંબરીંગ કરી રજીસ્ટ્રેશન કર્યા બાદ તે ઈસ્યુ કરવાની કામગીરી કરવામાં આવે છે.

રેકર્ડ વિભાગમાં સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રકાશિત થયેલ વિવિધ પ્રકાશનો પુસ્તકો/ સાહિત્ય / ભ્યુ.ડાયરી વિગેરેનું વેચાણ, સુરત મહાનગરપાલિકાના વિવિધ સમિતિઓના ઠરાવ, પેટા કાયદા મુજબ અરજદારોની માંગણી મુજબ ઠરાવની પ્રમાણિત નકલો આપવાની કામગીરી તેમજ સુરત મહાનગરપાલિકા દ્વારા જુદી જુદી કેડરની ખાલી જગ્યા ભરવા માટે અરજી ફોર્મનું વેચાણ કરવામાં આવે છે. સુરત મહાનગરપાલિકા દ્વારા યોજવામાં આવતા પુસ્તકમેળામાં પણ વિવિધ પુસ્તકોનું વેચાણ કરવામાં આવે છે. ઈલેક્શન ખાતા સાથે સંકલનમાં રહી મતદારયાદીનું વેચાણ રેકર્ડ ખાતા દ્વારા કરવામાં આવે છે.

ગુજરાત સરકાર દ્વારા પ્રસિદ્ધ થતાં ગુજરાત ગવર્નર્મેન્ટના વિવિધ ગેજેટની નકલો પ્રતિવર્ષ અત્રેથી લવાજમ ભરપાઈ કરી મંગાવવામાં આવે છે અને પાર્ટવાઈઝ છૂટા કરી તેનું વ્યવસ્થિત બાઈન્ડીંગ કરી બુક બનાવવામાં આવે છે, તેને રેકર્ડ અર્થે વ્યવસ્થિત જાળવણી કરવામાં આવે છે.

**(૨) કલમ-૪(૧)(બી)(૨) : સંસ્થાનાં અધિકારીઓ અને કર્મચારીઓની સત્તા અને ફરજો**

### ૧. સેક્શન ઓફિસર

- સેક્શન ઓફિસરના ડી.પી.ઓર્ડર હેઠળ સુપ્રત થયેલી તમામ કામગીરી.
- ખાતાના વિભાગીય વડા ડેપ્યુટી ભ્યુનિ. કમિશનરશ્રીના સંકલનમાં રહીને વખતો વખત મળતી સુચના/ખાતાને લગતી કામગીરી કરાવવી.
- સમગ્ર ખાતાનો વહીવટ સુગમ અને સરળ રીતે ચાલે તે જોવાની જવાબદારી તથા રેકર્ડ ખાતાનાં કર્મચારીઓને કામની સૌંપણી કરી કામગીરી કરાવવી તથા માર્ગદર્શન આપવું.
- રેકર્ડ વિભાગ દ્વારા અરજદારોને આપવામાં આવતાં ઠરાવની નકલ તેમજ પ્રમાણપત્રોને પ્રમાણિત કરવા.
- અલગ અલગ ઝોન/વિભાગ/ખાતાને ઉપયોગમાં લેવાના વિવિધ રજીસ્ટરો, રસીદ બુકો, ફોર્મ્સ વિગેરે સ્ટેશનરી અને બુકોના રજીસ્ટ્રેશનોની કામગીરી કરવી.

- દરવર્ષ જે તે વિભાગના નવા રજીસ્ટરોની રજીસ્ટ્રેશનની કામગીરી નિયત સમયમાં પૂર્ણ કરી જે તે વિભાગને પુરા પાડવા.
- રાઈટ ટુ ઈન્ફર્મેશન એક્ટ હેઠળની માહિતી અંગે અપીલ અધિકારી તરીકેની કામગીરી.
- નાગરિક અધિકાર પત્ર હેઠળ જાહેર જનતાને માહિતી પુરી પાડવી.
- હાજરીપત્રક મેઈન્ટેઇન કરવું તેમજ શિક્ષા અંગેની કામગીરી.
- તાબા હેઠળના કર્મચારીઓની રજા, પગાર વધારાનો ઈજાફો મંજૂર કરવા.
- કર્મચારીઓના ગુપ્ત અહેવાલ તૈયાર કરાવવા તથા જે તે કર્મચારીઓના ગુપ્ત અહેવાલનું ગ્રેડીંગ કરાવવું.
- વયમર્યાદા/સ્વૈચ્છિક નિવૃત થયેલ કર્મચારીઓના ગ્રેજ્યુઈટી/એડી ગ્રેજ્યુઈટી/પેન્શન ચુકવણી અંગેની ફાઈલ તૈયાર કરાવી નાણાં ચુકવણી અંગે કાર્યવાહી કરાવવી.
- ઓડીટ ઓફ્ઝેક્શન તેમજ બજેટને લગતી કામગીરી કરાવવી અને અન્ય વિવિધ પ્રકારની કામગીરી પર દેખરેખ રાખી ખાતામાં કરવામાં આવતા તમામ પ્રકારના કામો જડપી, સુગમ અને સરળ રીતે થાય તેના પર દેખરેખ રાખવી.
- ખાતાના વિવિધ પ્રકારના ડોક્યુમેન્ટ્સનું નિયમોનુસાર રેકર્ડ રૂલ્સ ૧૯૬૫ મુજબ A,B,C,D,E કેટેગરીમાં ફક્ત વર્ષવાર વર્ગીકરણ કરાવી નાશ/જમા કરાવવા સુધીની કામગીરી કરાવવી.

## ૨. પ્રથમ શ્રેષ્ઠી કલાક્ર

- તમામ દફ્તરી તથા અન્ય અગત્યની કામગીરીની કાર્યવાહી સેક્શન ઓફિસરશીના સંકલનમાં રહીને કરવી.
- રજીસ્ટ્રેશન કરવામાં આવતી બુકોની રજીસ્ટ્રેશન કાર્યવાહી થયેથી ચકાસણી કરવી.
- આરટીઆઈ એક્ટ હેઠળ આવતી અરજીઓના નિકાલની કામગીરી કરવી તથા આરટીઆઈ એક્ટ- ૨૦૦૫ અન્વયે જાહેર માહિતી અધિકારી તરીકે ફરજ બજાવવાની રહેશે.
- "નાગરિક અધિકાર પત્ર" એક્ટ હેઠળ જાહેર જનતાને પુરી પાડવાની માહિતી તૈયાર કરવી.
- બજેટ, એસ્ટાભ્લીશમેન્ટ, શીડ્યુલ વિગેરે કામગીરી.
- વાર્ષિક અહેવાલ તૈયાર કરવો.
- જનરલ એડવાન્સ રીકુપમેન્ટની કામગીરી.
- ખાતાની જરૂરિયાત મુજબ ટેન્ડરો બહાર પાડવાની કામગીરી.
- ખાતા દ્વારા કરાવવામાં આવતા કામોના વિવિધ પ્રકારના બીલોની ચકાસણી કરવા અંગેની કામગીરી.
- ખાતા દ્વારા વેચાણ કરવામાં આવતાં ફોર્મ્સ/પ્રકાશનોના વેચાણની ઉપજ-ટેન્ડર ફી વિ. હિસાબી ખાતામાં જમા કરાવવી.
- સેક્શન ઓફિસરશીના સંકલનમાં રહી રેકર્ડ વિભાગના તમામ પ્રકારના રેકર્ડનું ફક્ત વર્ષવાર વર્ગીકરણ કરી જાણવણી તેમજ નિભાવણીની કામગીરી કરવી તેમજ "નાશ પાત્ર રેકર્ડ" અંગે જરૂરી મંજૂરી મેળવી નાશ/જમા કરાવવા અંગેની કામગીરી હાથ ધરવી.
- મુવમેન્ટ રજીસ્ટર નિભાવવું તેમજ સેક્શન ઓફિસરશીની સુચના મુજબ કામગીરી તથા તમામ પ્રકારના સ્ટેશનરી છાપકામ લીસ્ટ અપડેટ કરાવવા.
- રેકર્ડ રૂલ્સ ૧૯૬૫ મુજબ દરેક ઝોન/ખાતામાંથી વર્ગીકરણ મુજબના રેકર્ડની ફક્ત વર્ષવાર ગોઈવણી કરવા તથા "નાશ કરવાપાત્ર રેકર્ડ" ના નાશ કરવા/નિકાલ કરવા અંગેની કાર્યવાહી.
- પુસ્તક મેળાને લગતી આનુસારાંગિક કામગીરી.
- વયમર્યાદા/સ્વૈચ્છિક નિવૃત થયેલ કર્મચારીઓના ગ્રેજ્યુઈટી/એડીગ્રેજ્યુઈટી/પેન્શન ચુકવણી અંગેની ફાઈલ તૈયાર કરી નાણાં ચુકવણી અંગે ઘટિત કાર્યવાહી કરવી.
- કર્મચારી/અધિકારીશીના મહેકમની દેખરેખ/રજા/ પગાર વધારાનો ઈજાફો મંજૂર કરાવવી.

### ૩. ત્રીજી શ્રેષ્ઠી કલાર્ક

- દરેક ખાતા / જોનમાં વપરાતી દરેક પ્રકારની બુકો, રજીસ્ટરો, ફોર્મ, હાજરીપત્રક વિગેરે નોંધણી કરવા અંગેની કામગીરી.
  - રજીસ્ટ્રેશન કરી નોંધણી રજીસ્ટર તથા ઈસ્યુ રજીસ્ટર નિભાવવાની કામગીરી.
  - આઉટવર્ડ/ઈનવર્ડ ડિસ્પેચને લગતી તમામ કામગીરી .
  - વિવિધ પ્રકાશનો—ફોર્મ્સ વિગેરેનું વેચાણ અંગેની કામગીરી.
  - ઝોન/ખાતામાંથી આવેલ વર્ગીકરણ મુજબના રેકર્ડની ફક્ત વર્ષવાર ગોઠવણી કરવા તથા "નાશ પાત્ર રેકર્ડ" નાશ કરવા/નિકાલ કરવા સંદર્ભની કાર્યવાહી.
  - જાહેરાતના ફોર્મ, પ્રિન્ટેડ રેકર્ડ, ભરણું તથા બહારના અરજદારો ધ્વારા માંગવામાં આવતા ઠરાવો તથા વસ્તીના આંકડાઓની નકલ પૂરી પાડવી, ડિસ્પેચ, એસ્ટાબ્લીશમેન્ટ, જનરલ રજીસ્ટરોની નોંધણી અંગેની કામગીરી.
  - મેગેજીનાં બીલો/કુરીયરના બીલો/વેપારી બીલો તથા અન્ય પ્રકારના બીલો મ્યુ.પ્રેસ વિભાગમાં મળ્યેથી સદર બીલોની સમયઅવધિમાં ચકાસણી કરાવીને ચુકવણી કરાવવા સુધીની કામગીરી.

૪. બુક બાઈ-ડર

- રેકર્ડ/ગોલ્ડ વર્ગોને બાઈ-ડીઝાની કામગીરી.

૪. પટિવાળી

- ઓફિસને લગતી કામગીરી તેમજ ટપાલ વહેંચવાની કામગીરી કરવી.

૬. બેલદાર

- વિવિધ ઝોન / ખાતાઓ તરફથી મળેલ જુના રેકર્ડ સુચના મુજબ વ્યવસ્થિત રીતે ફક્ત વર્ષવાર ગોઠવવાની તેમજ રેકર્ડ ઓફિસમાં સાફ્ટ-સફાઈ કરવાની કામગીરી કરવી.

(3) કલમ-૪(૧)(બી)(૩) : દેખરેખ અને જવાબદારીના માધ્યમ સહિત નિર્ણય લેવાની પ્રક્રિયામાં અનુસરવાની કાર્યરીતિ :-

## રેકર્ડ (કમ્પાઇલેશન એન્ડ નંબરીંગ) વિભાગ

સુરત મહાનગરપાલિકાના રેકર્ડ ખાતામાં નીચે જણાવેલ મંજુર સ્ટાફ શિડ્યુલ મુજબના કર્મચારીઓને  
કામની વહેંચણી કરેલ છે.

## —: રેકર્ડ વિભાગ :—

અ.નં	હોદ્દો	મંજૂર કરેલ જગ્યા			પુરાયેલ જગ્યા			ખાલી જગ્યા		
		કાયમી	હંગામી	કુલ	કાયમી	હંગામી	કુલ	કાયમી	હંગામી	કુલ
૧.	સેક્શન ઓફિસર	૦૧	૦૦	૦૧	૦૧	૦૦	૦૧	૦૦	૦૦	૦૦
૨.	પ્રથમ શ્રેણી કલાર્ક	૦૩	૦૦	૦૩	૦૧	૦૦	૦૧	૦૨	૦૦	૦૨
૩.	ત્રીજી શ્રેણી કલાર્ક	૧૨	૦૦	૧૨	૦૬	૦૦	૦૬	૦૩	૦૦	૦૩
૪.	બુક બાઈન્ડર	૦૧	૦૦	૦૧	૦૦	૦૦	૦૦	૦૧	૦૦	૦૧
૫.	પટાવાળા	૦૬	૦૦	૦૬	૦૪	૦૦	૦૪	૦૧	૦૦	૦૧
૬.	બેલદાર	૦૩	૦૦	૦૩	૦૩	૦૦	૦૩	૦૦	૦૦	૦૦
કુલ...		૨૬	૦૦	૨૬	૧૬	૦૦	૧૬	૦૭	૦૦	૦૭

નોંધ:- હાલ પુરાયેલ કુલ-૦૮ જગ્યાઓ પૈકી કુલ-૦૧ તથા પટાવાળાની કુલ-૦૫ જગ્યાઓ પૈકી કુલ-૦૧ અન્ય વિભાગમાં ઓનલોન ફરજ બજાવી રહ્યા છે.

મા.ડેપ્યુટી મ્યુનિ. કમિશનરશ્રી



કે.એકાઉન્ટન્ટ



સેક્રશન ઓફિસર



પ્રથમ શ્રેણી કલાક



ત્રીજી શ્રેણી કલાક



બુક બાઈન્ડર



પટાવાળા



બેલદાર

(૪) કલમ-૪(૧)(બી)(૪) : પોતાના કાર્યો બજાવવા માટે પોતે નક્કી કરેલા ધોરણો

A. વહીવટ :-

- ઝોન/ખાતામાં ઉપયોગમાં લેવાતા રજીસ્ટરો, બુકો, ખાતાકીય ફોર્મ વિગેરેનું રજીસ્ટ્રેશન કરવું.
- નોંધણી કરેલ બુકો/રજીસ્ટરોનું નંબર તથા સીલ અંગેની ચકાસણી કરી, રજીસ્ટ્રેશન તથા ખતવણી કરી, બુક તથા રજીસ્ટરો ઝોન/ખાતાને પૂરા પાડવાની કામગીરી.
- દરેક ઝોન/ખાતામાંથી આવેલ વર્ગીકરણ મુજબનો રેકર્ડ ફિક્ટ વર્ષવાર જમા લઈ જાણવણી, સાચવણી તથા રેકર્ડ નાશ કરવા અંગેની કામગીરી.
- દરેક ઝોન/ખાતાઓને તેમના રેકર્ડની જાણવણી તેમજ નિભાવવની સમય મર્યાદા પૂર્ણ થયેથી જેતે ઝોન/ખાતાઓને રેકર્ડ નાશ કરવા માટે જાણ કરવા અંગેની કામગીરી.
- નાગરિક અધિકાર પત્ર હેઠળ જાહેર જનતાને ઉપલબ્ધ માહિતી પુરી પાડવી.
- ખાતાના પત્રવ્યવહાર અંગેની કામગીરી

## B. વેચાણ :-

- સુરત મહાનગરપાલિકામાં શીડયુલની ખાલી જગ્યા ઉપર કર્મચારીઓની ભરતી અંગેના ફોર્મ તથા પ્રિન્ટેડ રેકર્ડની વેચાણની કામગીરી.
- ઝોન/ખાતા તથા જાહેર નાગરિકો તરફથી માંગવામાં આવતા ઠરાવો તથા વસ્તીના આંકડાઓની નકલોની નિયમાનુસાર જરૂરી ફી તથા કોર્ટ ફી વસુલ લઈ આપવાની કામગીરી.
- સુરત મહાનગરપાલિકાના અલગ અલગ વિભાગ તરફથી અતે જમા કરાવેલ "નાશ પાત્ર રેકર્ડ" નો ભાવપત્રક / ટેન્ડર પ્રક્રિયા કરી વેચાણથી આપવાની કામગીરી.
- રેકર્ડ વિભાગને (૧) સુરત સોનાની મૂરત (૨) સુરત ઈતિહાસ દર્શન ગ્રંથ-૧ (૩) સુરત ઈતિહાસ દર્શન ગ્રંથ-૨, (૪) સુરત એક દ્રોષ્પિપાત (૫) બ્રીજીસ ઈન સુરત સીટી (૬) સુરત શહેર સુધરાઈ શતાબ્દી ગ્રંથ (૭) સુરત વિઝન-૨૦૨૦ તથા (૮) ઉપલબ્ધ ગ્રીટીસ કાર્ડના વેચાણ કરવામાં આવે છે. જેને ધ્યાને રાખી સુરત મહાનગરપાલિકા ધ્વારા આયોજન કરવામાં આવતાં વાર્ષિક રાષ્ટ્રીય પુસ્તક મેળા તથા ફલાવર શોના આયોજન દરમ્યાન રેકર્ડ વિભાગને પણ ક્રમ નં. ૧ થી ૮ના પુસ્તકોના પ્રચાણ-પ્રસાર તથા વેચાણ અર્થે સ્ટોલ ફાળવવામાં આવે છે.

**કલમ-૪(૧)(બી)(૫) :** કાર્ય બજાવવા માટે અથવા નિયંત્રણ હેઠળના અથવા કર્મચારીઓ ધ્વારા ઉપયોગમાં લેવાતા નિયમો, વિનિયમો, સુચનાઓ, નિયમ સંગ્રહ અને રેકર્ડ :—

ધી. બી.પી.એમ.સી.એક્ટ સને-૧૯૪૮ – ગુજરાત રાજ્ય સેવા(વર્તણુંક) નિયમો – ગુજરાત રાજ્ય સેવા (શિસ્ત અને અપીલ) નિયમો.– સુરત મહાનગરપાલિકાનાં કર્મચારીઓને લગતાં જુદા જુદા ઠરાવો, વિનિયમો– ગુજરાત સરકારશ્રીના જુદા જુદા વિભાગો ધ્વારા વખતો વખત જાહેર થતાં ઠરાવો, પરિપત્રો, સુચનાની અમલવારી કરી વહીવટી કામો હાથ ધરવામાં આવે છે.

**કલમ-૪(૧)(બી)(૬) :** નિયંત્રણ હેઠળ હોય તેવા દસ્તાવેજોનું વર્ગીકરણઃ—

આ સાથે સામેલ પત્રક 'A' મુજબ

**કલમ-૪(૧)(બી)(૭) :** નિતી ઘડતરના અથવા તેના અમલીકરણના સંબંધમાં જનતાના સભ્યો સાથે વિચાર અને વિનિયમ માટે અથવા તેમના ધ્વારા રજુઆત માટેની વિધમાન કોઈ વ્યવસ્થાની વિગતો :—

જાહેર સત્તામંડળ સાથે સંયુક્ત છે. અતેના ખાતાની અલાયદી માહિતી નથી.

**કલમ-૪(૧)(બી)(૮) :** સલાહના હેતુઓ માટે બે અથવા તેથી વધુ વ્યક્તિત્વોના બનેલા બોર્ડ, કાઉન્સિલો, સમિતિઓ વગેરે

જાહેર સત્તામંડળ સાથે સંયુક્ત છે. અતેના ખાતાની અલાયદી માહિતી નથી.

**કલમ-૪(૧)(બી)(૮) :** અધિકારીઓ અને કર્મચારીઓની માહિતી પુસ્તિકા : -

**રેકર્ડ વિભાગનાં અધિકારી / કર્મચારીઓની માહિતી દર્શાવતું પત્રક**

જોન / ખાતાનું નામ : - રેકર્ડ (કમ્પાઈલેશન એન્ડ નંબરીંગ) વિભાગ ફોન નં. ૦૨૬૧-૨૪૭૮૯૩૬

અ.નં.	કર્મચારીના નામ/નંબર	કર્મચારી નં.	હોદ્દો	સરનામું
૧	શ્રી રાજેશ પી. મૈસુરિયા	૩૬૪૦૮	સેક્શન ઓફિસર	રેકર્ડ વિભાગ
૨	શ્રી ગણપત આર. પટેલ	૧૭૩૦૪	પ્રથમ શ્રેષ્ઠી કલાર્ક	સુરત મહાનગરપાલિકા
૩	શ્રી મેઘના એ. સારંગ	૪૭૪૦૮	ત્રીજી શ્રેષ્ઠી કલાર્ક	ભંડારીવાડ, શાકમાર્કેટ, દોટીવાલા બેકરીની પાછળ, નાનપુરા, સુરત.
૪	શ્રી ધીરેન બી. પટેલ	૪૭૪૧૦	"	
૫	શ્રી હિરેન ટી.કુદિયાણાવાળા	૪૭૪૪૨	"	
૬	શ્રી કૃતિ આર. વેપારી	૪૮૧૩૫	"	
૭	શ્રી જિજાસા પી. પરમાર	૪૮૮૮૮	"	
૮	શ્રી નેહા વિ. પ્રેસવાલા	૪૯૨૩૦	"	
૯	શ્રી પ્રવિષ્ણ એસ. પટેલ	૧૩૮૬૦	તાલીમાર્થી ત્રીજી શ્રેષ્ઠી કલાર્ક	
૧૦	શ્રી મહેશ આર. કપ્તાન	૧૩૮૬૨	"	
૧૧	શ્રી ખીમજી પી. ડાભી	૧૩૮૩૬	પટાવાળા	
૧૨	શ્રી મુકેશ એચ. રાઠોડ	૩૪૨૩૬	"	
૧૩	શ્રી જોન્ટી ડી.ખલાસી	૪૨૯૧૦	"	
૧૪	શ્રી મયુર એન. સોલંકી	૪૪૮૩૫	"	
૧૫	શ્રી નિલેશકુમાર કે.પટેલ	૬૦૦૩૨	બેલદાર	
૧૬	શ્રી વસંત જી.બોરીયા	૫૨૮૮૨	"	
૧૭	શ્રી શંભુ એમ. પટેલ	૭૩૮૮૬	તાલીમાર્થી બેલદાર	

**કલમ-૪(૧)(બી)(૧૦) : અધિકારીઓ અને કર્મચારીઓને મળતા માસિક મહેનતાણાં : -**

અ.નં.	અધિકારી/કર્મચારીનું નામ	હોદ્દો	પગાર ધોરણ
૧	શ્રી રાજેશ પી. મૈસુરિયા	સેક્શન ઓફિસર	૬૩૦૦-૩૪૮૦૦ ૩૪૪૦૦-૧૧૨૪૦૦
૨	શ્રી ગણપત આર. પટેલ	પ્રથમ શ્રેષ્ઠી કલાર્ક	૬૩૦૦-૩૪૮૦૦ ૪૪૯૦૦-૧૪૨૪૦૦
૩	શ્રી મેઘના એ. સારંગ	ત્રીજી શ્રેષ્ઠી કલાર્ક	૫૨૦૦-૨૦૨૦૦ ૧૬૯૦૦-૬૩૨૦૦
૪	શ્રી ધીરેન બી. પટેલ	"	૫૨૦૦-૨૦૨૦૦ ૧૬૯૦૦-૬૩૨૦૦
૫	શ્રી હિરેન ટી.કુદિયાણાવાળા	ત્રીજી શ્રેષ્ઠી કલાર્ક	૫૨૦૦-૨૦૨૦૦ ૧૬૯૦૦-૬૩૨૦૦
૬	શ્રી કૃતિ આર. વેપારી	"	૫૨૦૦-૨૦૨૦૦ ૧૬૯૦૦-૬૩૨૦૦
૭	શ્રી જિજાસા પી. પરમાર	"	૫૨૦૦-૨૦૨૦૦ ૧૬૯૦૦-૬૩૨૦૦
૮	શ્રી નેહા વિ. પ્રેસવાલા	ત્રીજી શ્રેષ્ઠી કલાર્ક	૫૨૦૦-૨૦૨૦૦ ૧૬૯૦૦-૬૩૨૦૦
૯	શ્રી પ્રવિષ્ણ એસ. પટેલ	તાલીમાર્થી ત્રીજી શ્રેષ્ઠી કલાર્ક	૫૨૦૦-૨૦૨૦૦ ૨૫૫૦૦-૮૧૧૦૦
૧૦	શ્રી મહેશ આર. કપ્તાન	"	૫૨૦૦-૨૦૨૦૦ ૨૫૫૦૦-૮૧૧૦૦

અ.નં.	અધિકારી/કર્મચારીનું નામ	હોદ્દો	પગાર ધોરણ
૧૧	શ્રી ખીમજી પી. ડાભી	પટાવાળા	૫૨૦૦-૨૦૨૦૦ ૨૫૫૦૦-૮૧૧૦૦
૧૨	શ્રી મુકેશ એચ. રાઠોડ	"	૫૨૦૦-૨૦૨૦૦ ૨૫૫૦૦-૮૧૧૦૦
૧૩	શ્રી જોન્ટી ડી.ખલાસી	"	૪૪૪૦-૭૪૪૦ ૧૫૭૦૦-૫૦૦૦૦
૧૪	શ્રી મયુર એન. સોલંકી	"	૪૪૪૦-૭૪૪૦ ૧૫૭૦૦-૫૦૦૦૦
૧૫	શ્રી નિલેશકુમાર કે.પટેલ	બેલદાર	૪૪૪૦-૭૪૪૦ ૧૫૭૦૦-૫૦૦૦૦
૧૬	શ્રી વસંત જી.બોરીચા	"	૪૪૪૦-૭૪૪૦ ૧૫૭૦૦-૫૦૦૦૦
૧૭	શ્રી શંભુ એમ. પટેલ	તાલીમાર્થી બેલદાર	ઓન ફીક્સ

**કલમ-૪(૧)(બી)(૧૧) :** તમામ યોજનાઓ, સુચિત ખર્ચ, ચુકવેલ નાણાં પરના અહેવાલોની વિગતો દર્શાવતું અંદાજપત્ર

બીસીએનટી વાઈઝ [www.suratmunicipal.gov.in](http://www.suratmunicipal.gov.in) પર સંયુક્ત રીતે મૂકવામાં આવેલ છે.

**કલમ-૪(૧)(બી)(૧૨) :** ફાળવેલ રકમો સહિત સબસીડી કાર્યક્રમોની અમલ બજવણીની રીત અને એવા કાર્યક્રમોના લાભાર્થીઓની વિગતો : -

જાહેર સત્તામંડળ સાથે સંયુક્ત છે. અતેના ખાતાની અલાયદી માહિતી નથી.

**કલમ-૪(૧)(બી)(૧૩) :** છુટકારો, પરવાનગીઓ અથવા અધિકૃતિઓ મેળવનારાની વિગતો જાહેર સત્તામંડળ સાથે સંયુક્ત છે. અતેના ખાતાની અલાયદી માહિતી નથી.

**કલમ-૪(૧)(બી)(૧૪) :** ઈલેક્ટ્રોનિક સ્વરૂપમાં ઉપલબ્ધ માહિતીઓને લગતી વિગતો :-

સ્થાયી સમિતિના (તા.૩૧/૧૨/'૧૬) સુધીના તથા સામાન્ય સભાના (તા.૩૧/૧૨/'૧૮) સુધીના ઠરાવોનું સ્કેનીંગ કરાવી સોફ્ટ કોપી (P.D.F.) ફાઈલમાં સાચવવામાં આવે છે.

**કલમ-૪(૧)(બી)(૧૫) :** જાહેર ઉપયોગ માટે નિભાવવામાં આવતા હોય તેવા ગ્રંથાલયોની વિગત : -

જાહેર સત્તામંડળ સાથે સંયુક્ત છે. અતેના ખાતાની અલાયદી માહિતી નથી.

**કલમ-૪(૧)(બી)(૧૬) :** જાહેર માહિતી અધિકારીઓના નામ, હોદ્દો અને બીજી વિગતો : -

સુરત મહાનગરપાલિકાની વેબસાઈટ [www.suratmunicipal.gov.in](http://www.suratmunicipal.gov.in) પર મૂકવામાં આવેલ છે. નજીકના ટુંકાગાળામાં ફેરફાર થયેલ હોય તે સિવાય મહદૂઅંશો સંયુક્ત રીતે મૂકવામાં આવેલ છે. તે સમયાંતરે અધ્યતન કરવામાં આવે છે.

...૯...

**કલમ-૪(૧)(બી)(૧૭) : ઠરાવવામાં આવે તેવી બીજી માહિતી :-**

- **R.T.I. એક્ટ-૨૦૦૫ હેઠળ નિભાવવાના રજીસ્ટરો**

એપ્રિલ-૨૦૨૩ થી જૂન-૨૦૨૩ રજીસ્ટર નમૂનો-૧  
જુલાઈ-૨૦૨૩ થી સપ્ટે.-૨૦૨૩ રજીસ્ટર નમૂનો-૧  
ઓક્ટો.-૨૦૨૩ થી ડિસે.-૨૦૨૩ રજીસ્ટર નમૂનો-૧  
જાન્યુ.-૨૦૨૪ થી માર્ચ-૨૦૨૪ રજીસ્ટર નમૂનો-૧

એપ્રિલ-૨૦૨૩ થી જૂન-૨૦૨૩ રજીસ્ટર નમૂનો-૨  
જુલાઈ-૨૦૨૩ થી સપ્ટે.-૨૦૨૩ રજીસ્ટર નમૂનો-૨  
ઓક્ટો.-૨૦૨૩ થી ડિસે.-૨૦૨૩ રજીસ્ટર નમૂનો-૨  
જાન્યુ.-૨૦૨૪ થી માર્ચ-૨૦૨૪ રજીસ્ટર નમૂનો-૨

SD/-  
**જાહેર માહિતી અધિકારી**  
અને  
**પ્રથમ શ્રેષ્ઠી કલાર્ક**  
**રેકર્ડ વિભાગ**  
**સુરત મહાનગરપાલિકા.**

## A B C D,E કેટેગરીમાં વર્ગીકરણ અંગેનું પત્રક - "A"

### "A" કેટેગરી (કાયમ)

૧. પ્રોસીડરી (ઠરાવ) બુક
૨. કર્મચારીની S.B.
૩. ડેડસ્ટોક ૨જીસ્ટર
૪. ગેજેટ/રાજ્ય પત્રો
૫. S.O. રેકર્ડ વિભાગનાં ડી.પી. ઓર્ડર
૬. "નાશ કરવા પાત્ર" રેકર્ડ નાશ કર્યા અંગેની યાદી

### "B" કેટેગરી (૨૫ થી ૩૦ વર્ષ)

૧. રેકર્ડ ખાતામાંથી બહાર પાડવામાં આવેલ ટેન્ડર ફાઈલ

### "C" કેટેગરી (૧૦ વર્ષ)

૧. રસીદબુક (સામાન્ય પહોંચ)
૨. બીલ ૨જીસ્ટર
૩. રીફન્ડ ૨જીસ્ટર + ખતવણી ૨જીસ્ટર
૪. ઈનવર્ડ ૨જીસ્ટર
૫. આઉટવર્ડ ૨જીસ્ટર
૬. મતદાર યાદી/ઇલેક્શન વોર્ડના નકશા/વસ્તી ગણતરીની માહિતી અંગેની ફાઈલ/૨જીસ્ટર.
૭. ૨જીસ્ટર/રસીદબુક/ફોર્મ્સ વિગેરેના નંબરીંગ કરાવવા પરીપત્ર બહાર પાડવાની મંજુરીની ફાઈલ
૮. ભરણા ૨જીસ્ટર
૯. દૈનિક પેપર પસ્તી વેચાણની ફાઈલ
૧૦. R.T.I. – ૨૦૦૫ અંગે આવેલ અરજીનું નોંધ ૨જીસ્ટર તથા અરજી નિકાલ
૧૧. R.T.I. – ૨૦૦૫ અંગે આવેલ અપીલનું નોંધ ૨જીસ્ટર તથા અરજી નિકાલ
૧૨. પગાર રોલ પત્રક
૧૩. મહેકમ ૨જીસ્ટર
૧૪. સ્ટોક ૨જીસ્ટર
૧૫. સીક્યુરીટી ડિપોઝિટ ૨જીસ્ટર
૧૬. કર્મચારી હાજરી પત્રક

### "D" કેટેગરી (૫ વર્ષ)

૧. રસીદ બુક નોંધ ૨જીસ્ટર

૨. અરજી ફોર્મ વિતરણ રજીસ્ટર અને ફાઈલ
૩. ટપાલ બુક
૪. હિસાબીખાતાના આવક/ખર્ચનાં પત્રકો
૫. સ્ટેમ્પ રજીસ્ટર
૬. જાહેર માહિતી અધિકાર પત્ર
૭. સુ.મ.પા. ના જે તે વિભાગમાંથી મંગાવેલ ઠરાવો/માહિતીની ફાઈલ
૮. રેકર્ડ ખાતાનો વાર્ષિક અહેવાલ
૯. વહીવટી અહેવાલ બુક
૧૦. વિવિધ પ્રકાશનો વેચાણ અંગેનું રજીસ્ટર
૧૧. કેશ રીસિપ્ટ વાઉચર
૧૨. નોંધ/પરિપત્ર/ઓફિસ ઓર્ડરની ફાઈલ
૧૩. વળતર રજાનું રજીસ્ટર
૧૪. સિક્યુરિટી ગાર્ડની હાજરી
૧૫. વિજિલન્સ વિભાગ રીપોર્ટ ફાઈલ
૧૬. રંગીન કાપડ ખરીદીની ફાઈલ
૧૭. લવાજમની ફાઈલ
૧૮. જનરલ એડવાન્સનું હિસાબી ખાતામાં રીકુપમેન્ટ
૧૯. એસ્ટા શીડ્યુલ
૨૦. ઓનલાઈન વેબ ફરિયાદ રજીસ્ટર
૨૧. જી સંકલન જરૂરી પુર્તતા અંગેની ફાઈલ
૨૨. ઈન્ડેટ બુક/રીકવીઝન બુક
૨૩. ઈજનેરી વિભાગને લાગત સ્ટેશનરી, ખતવણી રજીસ્ટર તથા નોંધણી રજીસ્ટર
૨૪. સામાન્ય પહોંચ – વર્કડાયરી – ટિકિટસ્ક્રીન – ફોર્મ્સ – ડીપોઝીટ બુક નોંધણી રજીસ્ટર
૨૫. આરોગ્ય વિભાગ – માર્કેટ ખાતા – સોલિડ વેસ્ટ વિભાગની સ્ટેશનરી નોંધણી રજીસ્ટર
૨૬. આરોગ્ય વિભાગ – મેડીકલ કોલેજ – હોસ્પિટલ / મેટરનીટી હોમ – હેલ્થ સેન્ટર – મેડીકલ સ્ટોરમાં વપરાતી સ્ટેશનરી નોંધણી રજીસ્ટર
૨૭. જનરલ નોંધ રજીસ્ટર
૨૮. બિલ વાઉચર ફાઈલ
૨૯. પરચુરણ પત્રવ્યવહાર/ O/C ની ફાઈલ
૩૦. ઠરાવની નકલ મેળવવાની અરજી
૩૧. નાગરીક અધિકાર નિકાલ અંગેના રીપોર્ટની ફાઈલ
૩૨. નકલ ફી ખતવણી રજીસ્ટર

૩૩. કાયમી તસલમાત રજીસ્ટર
૩૪. જાહેરાત અરજીના ઈસ્યુ વાઉચર અંગેની ફાઈલ
૩૫. રીપોર્ટ / મરામત અંગેના રીપોર્ટની ફાઈલ
૩૬. કર્મચારી ક્રીટ રજીસ્ટર
૩૭. મતદાન યાદી રજીસ્ટર
૩૮. વર્તમાનપત્રોનું જમાનોધ રજીસ્ટર
૩૯. કર્મચારી મેમો અંગેની ફાઈલ
૪૦. રેકર્ડ માંગણી અંગેના રીપોર્ટની ફાઈલ
૪૧. રેકર્ડ જમા કરવા અંગેના રીપોર્ટની ફાઈલ
૪૨. રેકર્ડ લઈ જવા / જમા કરવા અંગેનું રજીસ્ટર

### **"E" કેટેગરી (ર વર્ષ)**

૧. અલગ અલગ કેડરમાં ભરતી અંગેની જાહેરાતની ફાઈલ
૨. વિવિધ સમિતિઓના એજેન્ટા
૩. C.L. રીપોર્ટ તથા કાર્ડ
૪. સેન્ટર સ્ટોરમાંથી માલ-સામાન મેળવવા કરવામાં આવતી ડિમાન્ડના પેપર્સ
૫. સી.આર. ફોર્મ માંગણી અંગેના રીપોર્ટની ફાઈલ
૬. અંદાજપત્રની બુક
૭. ઓડિટ અહેવાલની બુક
૮. ડિઝસ્ટર મેનેજન્ટની બુક
૯. રજીસ્ટ્રેશન કરવા અંગેના રીપોર્ટ
૧૦. અન્ય ખાતાની ટેન્ડર નોટિસની નકલ

SD/-  
 જાહેર માહિતી અધિકારી અને  
 પ્રથમ શ્રેણી કલાર્ક  
 (રેકર્ડ વિભાગ)  
 સુરત મહાનગરપાલિકા

એનેક્શર-એ

સામાન્ય વહીવટ વિભાગના તા. ૧/૫/૨૦૦૮ ના પરિપત્ર કમાંક-  
પીએડી/૧૦-૨૦૦૭-૩૩૫૩૬૪-આર.ટી.આઈ. સેલનું બિડાશ

—:પ્રમાણપત્ર:—

આથી પ્રમાણિત કરવામાં આવે છે કે, મારી વડી કચેરી (પ્રોપર) તથા મારા વહીવટી કાર્યક્ષેત્રના આ સાથેની યાદી મુજબના જાહેર સત્તામંડળો દ્વારા માહિતી અધિકાર અધિનિયમના કલમ-૪ અંતર્ગત સ્વયં જાહેર કરવાની બાબતો (પ્રોએક્ટીવ ડીસ્કલોઝર) (પી.એ.ડી.) તેથાર કરવામાં આવી છે અને તા.૦૧/૦૫/૨૦૨૪ ની સ્થિતિએ તે અધતન કરવામાં આવેલ. જેનું અમારા દ્વારા માહે મે-૨૦૨૪ દરમ્યાન ઈન્સ્પેક્શન કમ ઓડીટ કરવામાં આવ્યું છે અને જે બાબતે ક્ષતિ જણાઈ હતી અગાર તો અપુરતી વિગતો જણાય હતી જે પૂર્તતા કરાવવામાં આવી છે.

તા.૦૧/૦૫/૨૦૨૪ ની સ્થિતિએ હવે કોઈ જાહેર સત્તામંડળોના પ્રોએક્ટીવ ડીસ્કલોઝર (પી.એ.ડી.) નું ઈન્સ્પેક્શન-કમ-ઓડીટ બાકી રહેલ નથી.

તા.૦૪/૦૬/૨૦૨૪  
મુખ્ય મથક:- રેકર્ડ વિભાગ.  
સુરત મહાનગરપાલિકા.

SD/-  
દેખુટી મ્યુનિ. કમિશનર  
સુરત મહાનગરપાલિકા.

સાદર ૨૪,

Sub: વેબસાઈટ ([www.suratmunicipal.gov.in](http://www.suratmunicipal.gov.in)) પર માહિતી અધતન હોવા  
બાબતનું પ્રમાણપત્ર

આથી પ્રમાણપત્ર આપવામાં આવે છે કે રેકર્ડ વિભાગને લગતી તમામ લાગત માહિતી જેવી કે પ્રોજેક્ટની વિગત, અધિકારી કર્મચારીની માહિતી, RTI અંતર્ગત પ્રોએક્ટીવ ડિસ્કલોઝર વિગેરે અત્રેથી ચકાસવામાં આવેલ છે અને તે તા.૦૧/૦૫/૨૦૨૪ મુજબ અધતન છે.

વેબસાઈટ અપડેટ બાબતનું પ્રમાણપત્ર ડેયુટી કમિશનરશ્રી મારફત ઈન્ફર્મેશન સિસ્ટમ વિભાગને મોકલાવવા મંજૂરી મળવા વિનંતી.

SD/-  
જાહેર માહિતી અધિકારી અને  
પ્રથમ શ્રેષ્ઠી કલાર્ક  
(રેકર્ડ વિભાગ)  
સુરત મહાનગરપાલિકા.

SD/-  
એપેલેટ અધિકારી અને  
સેક્શન ઓફિસરશ્રી  
રેકર્ડ વિભાગ.

SD/-  
મા.ડેયુટી મ્યુનિ. કમિશનરશ્રી,  
સુરત મહાનગરપાલિકા.

સાદર રજૂ,

સવિનય રીપોર્ટ જે, માહિતી અધિકાર અધિનિયમ-૨૦૦૫ ની કલમ-૪ પ્રમાણે દરેક જાહેર સત્તા મંડળના દરેક જાહેર માહિતી અધિકારીએ તેઓના નિયંત્રણ/તાબા હેઠળ ઝોન/ખાતાઓની સ્વયં જાહેર કરવા યોગ્ય માહિતી (પ્રોએક્ટીવ ડિસ્કલોગ્ર) સમયે-સમયે અધતન કરી સુરત મહાનગરપાલિકાની વેબસાઈટ ઉપર પ્રદર્શન કરવાની રહે છે.

દેખ્યુટી ભ્યુનિ.કમિશનર અને નોડલ ઓફિસરશ્રી આરટીઆઈ સેલ/૧૩, તા.૨૬/૦૪/૨૦૨૪ અન્વયે માહિતી અધિકાર અધિનિયમ-૨૦૦૫ ની કલમ-૪ ની જોગવાઈ મુજબ રેકર્ડ વિભાગની તા. ૦૧/૦૫/૨૦૨૪ ની સ્થિતિએ ૧ થી ૧૭ મુદ્દાની માહિતી તૈયાર કરી આ સાથે સાદર કરેલ છે, જેનાથી વિદ્યિત થવા વિનંતી.

ઉક્ત માહિતી સુરત મહાનગરપાલિકાના વેબસાઈટ ઉપર પ્રસિદ્ધ કરવા મંજૂરી મળવા તથા સામેલ પ્રમાણપત્ર "એનેક્ષર-એ" પર સહી થઈ આવવા વિનંતી.

SD/-  
જાહેર માહિતી અધિકારી અને  
પ્રથમ શ્રેણી કલાર્ક  
(રેકર્ડ વિભાગ)  
સુરત મહાનગરપાલિકા.

SD/-  
એપેલેટ અધિકારી અને  
સેક્શન ઓફિસરશ્રી,  
રેકર્ડ વિભાગ.

SD/-  
મા. દેખ્યુટી ભ્યુનિ. કમિશનરશ્રી,  
સુરત મહાનગરપાલિકા